https://archive.org/details/bk786/page/n0/mode/1up

All Items on https://archive.org/details/realpatidar
realpatidar.com
Full Library on https://realpatidar.com/library

શ્રી બોરડીટીમ્બા વિજયમંડળ

કડવા પાટીદાર

જ્ઞાતિ સંમેલન

અને

બંધારણ

પ્રકાશિતઃ—
નારાયણભાઈ રતનસિંહભાઈ પટેલ
ગામ શાન્તીપુરા કમ્પા (ગુજરાત)

સ્થાપનાઃ-		પ્રસિદ્ધઃ-
સને ૧૯૮૪	પ્રત ૧૫૦	સંવત ૨૦૦૦
		માગશર વદ ૫

realpatidar.com

https://archive.org/details/bk786/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 18, 19, 23, 24, 25, 27, 31.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

https://archive.org/details/bk786/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.19 15:44:39 +05'30'

realpatidar.com

શ્રી બોરડીટીમ્બા વિજય મંડળ

કડવા પાટીદાર

જ્ઞાતિ સંમેલન

અને

બંધારણ

Actually it is Kutch Kadva Patidar Gyanti Sammelan

પ્રકાશિત:—

નારાયણભાઈ રતનસિંહભાઈ પટેલ

ગામ શાન્તીપુરા કમ્પા (ગુજરાત)

સ્થાપના:-		પ્રસિદ્ધ:-
સને ૧૯૮૪	પ્રત ૧૫૦	સંવત ૨૦૦૦
		માગશર વદ ૫

VSAK: 16-Dec-1943

Should be Samvat 1984 i.e., 1927-28

realpatidar.com

https://archive.org/details/bk786/page/n3/mode/1up

realpatidar.com

realpatidar.com

https://archive.org/details/bk786/page/n4/mode/1up

realpatidar.com

બોરડી ટીમ્બા વિજય મંડળના
સંમેલનનો અહેવાલ

॥ हरी ॐ ॥

वन्दे देव उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणम् ।
वन्दे पन्नग भूषणं मृगधरं वन्दे पशुनां पतिम् ॥
वन्दे सूर्य शशांक वह्निनयनं वन्दे मुकुंद प्रियम् ।
वन्दे भक्त जनाश्रयं चः वरदं वन्दे शिवं शंकरम् ॥

શ્રી પરમ કૃપાળુ પરમાત્માની પૂર્ણ કૃપાથી, અને શ્રી કુળદેવી ઉમીયા માતાજીની અમીદ્રષ્ટિથી, આપણી જ્ઞાતિની દીવસાનોદિવસ ઉન્નતી થઇ રહી છે. અને પ્રગતિના પંથે પ્રયાણ કરી રહી છે.

આ જાગૃતિના જમાનામાં દરેક જ્ઞાતિ, પોતાની ઉન્નતી કેમ થાય, તેના પ્રયત્નો કરી રહી છે, અને દેશકાળ તથા સમય અનુસાર, પોતાની જ્ઞાતિના બંધારણોમાં ઘટતા સુધારા વધારા કરે જાય છે. તેવીજ રીતે આપણી જ્ઞાતિમાં પણ દેશકાળને અનુસરી, રૂઢી રીવાજોમાં ઘટતા સુધારા વધારા કરવાની આવશ્યક્તા હતી; પરંતુ આ કાર્યની પ્રથમ શરૂઆત કરનાર ઉત્સાહી, અને સેવાભાવી, કાર્યકરની જરૂરિઆત હતી. અને તે આપણી જ્ઞાતિના પૂન્ય પ્રતાપે તેવા ઉત્સાહી, અને સેવા ભાવની ધગશવાળા શ્રીયુત હરીભાઈ કરમશીભાઇ પટેલ, રહીશ ગામ મોતેશરીના હ્રદયમાં પ્રભુએ પ્રેરણા કરી, અને તેઓશ્રીએ ભગીરથ પ્રયાસ આદરી, આપણી જ્ઞાતિના દરેક કમ્પે ફરી, સુધારા વધારાના ઠરાવો ઘડવા પર સ્હાનુભુતિની સહીઓ એકત્ર કરી. તેજ અરસામાં પૂજ્ય મહારાજશ્રી દયાળદાસજીનું શુભ આગમન ગુજરાતમાં થયું જાણી, શ્રી હરીભાઇ કરમશીભાઇ પટેલ મહારાજશ્રીને મળ્યા. અને તેમની સમક્ષ જ્ઞાતિ સુધારા કરવા બાબતની પોતાના હ્રદયની શુદ્ધ ભાવના પ્રદર્શીત કરી. જેને મહારાજશ્રીએ અનુમોદન આપ્યું. આથી હરીભાઇ તથા મહારાજશ્રી બન્ને ગામ શ્રી રામપુર

realpatidar.com

https://archive.org/details/bk786/page/n5/mode/1up

realpatidar.com

(તાબે માલપુર) માં ગયા, અને ત્યાંના સર્વ ભાઇઓને એકત્રીત કરી સદરહુ વિષય પર જ્ઞાતિની જનરલ મીટીંગ ભરવાનું ધ્યાન કર્યું. અને તે ગામના શ્રી પા. હંસરાજભાઈ નારણભાઈ તથા પા. નથુભાઈ લધાભાઇ તથા પા. વાલજીભાઇ પ્રેમજીભાઇ અને અન્ય ભાઇઓ સહમત થયા. અને જનરલ મીટીંગ કયે સ્થળે ભરવી, તેની ચર્ચા ચાલી. અંતમાં તેજ ગામના ઉત્સાહી ભાઇઓએ માગણી કરી, કે જો જ્ઞાતિ ગંગા અમારા આંગણે પધારી અમને પાવન કરવાની કૃપા કરે તો અમો પૂજ્ય જ્ઞાતિ માતાની સેવા ઉઠાવવા તન, મન અને ધનથી તૈયાર છીએ.

VSAK: 26-Nov-1943

છેવટે તેજ ગામે એટલે રામપુરા મધ્યે જનરલ મીટીંગ ભરવાનો નિર્ણય થયો. અને સંવત ૨૦૦૦ ના કારતક વદ ૧૪ શુક્રવારના રોજની મીતિ નક્કી કરી. દરેક ગામે આપણા ભાઇઓને રામપૂરા કંથે ઉપરની મીતિએ, પધારવાની આમંત્રણ પત્રીકાઓ મોકલવામાં આવી. તે અરસાની અંદર એક મહાન દુઃખદ પ્રસંગ ઉપસ્થીત થયો, જેનું વર્ણન કરતાં પણ આઘાત થાય. અને તે એ કે ભાઇશ્રી હંસરાજભાઈ નારણભાઇની પુત્રી નામે બાઇ મોંઘીબાઇ, ફકત ૧૨ વર્ષની નાની ઉંમરે સ્વર્ગવાસ પામી.

આવા અણુધાર્યા દુઃખદ પ્રસંગે, સભા મુલતવી રાખવાનો વિચાર થયો, પરંતુ ધર્મની સાચી ધગશવાળા જ્ઞાતિઉન્નતિના સાચા હીમાયતી, ભાઇશ્રી હંસરાજભાઇએ પોતાને ત્યાં બનેલ મહાન દુઃખદ પ્રસંગનો શોક સમાવી, સભા ભરવાનો આગ્રહ કર્યો અને સભા ભરવાનું કાયમ રાખવામાં આવ્યું. ધન્ય છે આવા ધર્મવીરોને.

નક્કી કરેલી તીથીએ, દરેક ગામના સુધારક બંધુઓ પધાર્યા. અને તેમનો ભાવભીનો સત્કાર કરવામાં આવ્યો. અને તેજ રાત્રે જનરલ સભાનું કામ ઉત્સાહપૂર્વક ચાલુ કરવામાં આવ્યું હતું.

શરૂઆતમાં પ્રભુપ્રાર્થના બાદ આજની સભાના પ્રમુખ તથા સેક્રેટરીની ચુંટણીની દરખાસ્ત રજુ થઈ હતી. જેમાં સર્વાનુમતે રા. સ. ભાઇશ્રી હંસરાજભાઇ નારાણભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. જેનો આભાર સાથે સ્વીકાર કરી, પ્રમુખ સાહેબે પોતાનું સ્થાન તાલીઓના હર્ષનાદ સાથે શોભાવ્યું હતું. અને સેક્રેટરી તરીકે મી. કરસનભાઇ પંચાણભાઇ પટેલ ગામ બોરડી-ટીમ્બાવાળાને સર્વાનુમતે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અને તેઓશ્રીએ પણ આભાર સાથે પોતાનું સ્થાન લીધું હતું. ત્યાર બાદ—

realpatidar.com

https://archive.org/details/bk786/page/n6/mode/1up

realpatidar.com

પ્રમુખ સાહેબનું ભાષણ

પૂજ્ય મહારાજશ્રી તથા સુજ્ઞ જ્ઞાતિ બંધુઓ,

આપે મારા પ્રત્યે અપાર લાગણી બતાવી, આજની સભાના પ્રમુખ તરીકે ચુંટણી કરી, મને કૃતાર્થ કર્યો છે. જો કે આ સ્થાનને શોભાવે તેવા મારા કરતાં પણ લાયક ભાઇઓ છે, છતાં પણ આપ સર્વની મારા પ્રત્યે પસંદગી ઉતરી, તો જ્ઞાતિસેવા ખાતર આપની આજ્ઞા શીરોમાન્ય કરી, આપના આપેલા સ્થાને બીરાજું છું.

મહારાજશ્રી દયાળદાસજીનું ભાષણ

સજ્જનો! આ સભામાં આજે કચ્છ–કડવા પાટીદાર ભાઇઓની વધુ પ્રમાણમાં હાજરી જોઈ, મને ઘણોજ આનંદ થાય છે. સ્વધર્મ ઉપર આટલા મજબુત થયા છો, અને હંમેશાં પ્રભુ આપને આત્મબળ આપે એમ ઇચ્છું છું કારણ કે;—

॥ स्वः धर्मे नीःधनंश्रेयः परधर्मो भयावहः ॥

ભાવાર્થ—પોતાના ધર્મમાં રહીને નિર્ધન હોવાં છતાં, પણ શ્રેષ્ઠકારક છે. અને પરધર્મ ભયને આપવાવાળો છે. માટે પોતાના ધર્મમાં અડગ નિષ્ઠા રાખીને, પ્રાણાંત સુધી પણ ચલાયમાન થવું નહિ. એજ મનુષ્ય જન્મની સાફલ્યતા છે. અને આજની સભામાં ધર્મના દ્રઢ સિદ્ધાંતોને પ્રગતિમાં લાવવાનું અત્રે એકત્ર મળેલા ભાઈઓને પરમ કૃપાળુ પરમાત્મા આત્મબળ આપે, એવી પ્રભુ પ્રત્યે મારી નમ્ર પ્રાર્થના કરી, અત્રે હું વીરમું છું.

વાલજીભાઇ પ્રેમજીભાઈનું ભાષણ

મહેરબાન પ્રમુખ સાહેબ, તથા બંધુઓ, માતાઓ અને બહેનો;

પૂજ્ય મહારાજશ્રીએ આપણને સ્વધર્મના સિદ્ધાંતો સમજાવ્યા છે. આદી અનાદીથી આપણો સનાતન ધર્મ ચાલ્યો આવે છે. અને તે પ્રમાણે પૂર્ણ શ્રદ્ધા અને અડગ ટેકથી, પાલન કરતા આવ્યા છીએ પરંતુ તેની સાથે આપણા આચારવિચારો પણ શુદ્ધ રાખવા જોઈએ. આપણો કુળાચાર ઉત્તમ હોવો જોઈએ. આપણે ખેડુતવર્ગના માણસો છીએ, તેથી કામને લીધે આપણાથી વધારે ન બની શકે, તો પણ સ્નાન કરી, પછીથી કામકાજ કરવું. તેમાં કાંઇ વધારે ટાઇમ લાગતો નથી. અને તે આપણ દરેકથી

realpatidar.com

realpatidar.com

બની શકે છે, માટે આચાર વિચાર ઉચ્ચ કોટીના હોવા જોઇએ. અને તેના માટે દરેક સજ્જનો કોશિષ રાખશે, તેવી મારી નમ્ર વીનંતી છે.

—: પા. નારણભાઇ રતનશીભાઇનું ભાષણ :—

મહેરબાન પ્રમુખ સાહેબ તથા અત્રે પધારેલા ભાઇઓ તથા બ્હેનો,

ભાઇશ્રી વાલજીભાઇએ જે ભાષણ આપ્યું, તેને હું હાર્દિક ટેકો આપું છું. તેવીજ રીતે દેશકાળને અનુસરી આપણા ચાલતા આવતા, રીત રીવાજોમાં પણ ઘટતા સુધારા વધારા કરવાની જરૂર છે, માટે એ બાબતોમાં આપ સર્વ ભાઇઓએ મળીને એકમત થઈ, ઠરાવો પસાર કરવા એવી વીનંતી છે.

Sant Odhavram's message

પુજ્યપાદ મહારાજ શ્રી ઓદ્ધવરામજીનું લેખીત નીવેદન વાંચી સંભળાવવામાં આવ્યું હતું. તે નીચે મુજબ—

સ્વસ્તિ શ્રી અણીયોર ઉર્ફે રામપૂરા શુભ સ્થાને શિષ્ય દયાળદાસ તથા પાટીદાર ભાઇઓ સમસ્તની દીર્ઘાયુષ.

સંત ઓધવરામ: સતપંથ (ધારાધોરણ પ્રમાણે વર્તે નહીં) સાથે ખાવા પીવાનો વ્યવહાર બંધ કરો

ઇશ્વરનગરથી લી. ભિક્ષુક ઓદ્ધવદાસજીના શુભાશીષ, સાથે લખવાનું કે ગામ રામપુરા સ્થાને સમસ્ત ભાઇઓ ભેગા મલીને ધારા ધોરણો નક્કી કરવાનાં છો, તે સાંભળી મને ઘણો જ આનંદ થયો છે. પણ બંધારણો એવાં કરો, કે સર્વ ભાઇઓથી નભી શકે. અને તે ધારાધોરણ પ્રમાણે વર્તે નહિ, તેના સાથે ખાવા પીવાનો વહેવાર બંધ કરવો. સભાની અંદર મને તેડાવો છો, હું પણ આવું, પરંતુ મારૂં કામ મારો શિષ્ય દયાળદાસજી કરી શકે તેમ છે. બનતાં સુધી મને તકલીફ આપશો નહિ. ધર્મ માટે ચક્રવર્તિ રાજાઓએ પ્રાણ અર્પણ કરેલા છે. એમ સમજી ધર્મમાં અડગ શ્રદ્ધા રાખશો, એવો મારો સર્વ ભાઇઓને શુભ આશીર્વાદ છે.

રીત રિવાજો નક્કી કરવામાં આવ્યા

ત્યારબાદ કેટલીક ચર્ચાઓ ચાલી, અંતે ધારાધોરણ તથા રીત રીવાજોના ઠરાવો નક્કી કરવામાં આવ્યા હતા. ત્યારપછી સર્વાનુમતે એવો મત થયો, કે આપણું કેન્દ્રસ્થાન શ્રી. બોરડીટીમ્બા છે. તો ત્યાં પણ તાજેતરમાં એક મીટીંગ ભરાય તો ઘણું જ સારૂં. આ વાત સર્વ ભાઇઓએ મંજુર કરતાં, બાકીનું કામ મુલતવી રાખી સભા વિસર્જન કરવામાં આવી હતી.

બોલો શ્રી. લક્ષ્મીનારાયણ દેવકી જય ॥ સનાતન ધર્મકી જય

શાન્તી શાન્તી શાન્તી

realpatidar.com

https://archive.org/details/bk786/page/n8/mode/1up

realpatidar.com

ॐ तत्सत् परमात्मने नम :

ब्रह्मानंदं परम सुखदं केवलं ज्ञान मूर्तिम्
द्वंद्वातितं त्रिगुण रहितं तत्वमस्यादी लक्षम्
एकम् नित्यं विमल मचलं सर्वधी साक्षि भूतम्
भावातितं गगन सद्रशं सद्गुरुं त्वां नमामि

VSAK: 15-Dec-1943

ગામ શ્રી બોરડીટીમ્બા સંવત ૨૦૦૦ ના માગશર વદ ૪ વાર બુધ તા. ૧૫ મી ડીસેમ્બર, સને ૧૯૪૩ નાં રોજે ગ્રામ્યવાસીઓની કાર્યવાહક કમીટીની મીટીંગ ભરવામાં આવી હતી. જેના પ્રમુખસ્થાને ભાઇ શ્રી. પા. વેલજીભાઈ વાલજીભાઈ તથા સેક્રેટરીના સ્થાને, મી. ખીમજીભાઇ લવગણ-ભાઇની નીમણુંક કરવામાં આવી હતી. મીટીંગ બોલાવવાનો ઉદ્દેષ એ જ હતો, કે આવતી કાલે આપણે આંગણે પતિત પાવની જ્ઞાતિ માતાના સુપુત્રો પધારશે, તો તેમનું સ્વાગત કેવી રીતે કરવું અને સભાનું કામકાજ પદ્ધતિસર અને શાંતિપૂર્વક ચાલે, તે માટે લાયક, નિડર અને ઉત્સાહી, કેપ્ટનો (૨) તથા વોલન્ટીયરો (૨૮)ની ચુંટણીઓ કરી, મુકરર કરવામાં આવ્યા હતા. અને તેઓને કેવી રીતે કામકાજ કરવું, તેની પદ્ધતિની સુચનાઓ કરવામાં આવી હતી. તે કાર્યને ઉત્સાહપૂર્વક બજાવવા, તેઓએ તત્પરતા બતાવી હતી. ત્યારબાદ સભાનું કાર્ય તા. ૧૬-૧૨-૧૯૪૩ ના દીને મુલતવી રાખી, સભા વિસર્જન કરવામાં આવી હતી.

બોલો શ્રી. લક્ષ્મીનારાયણ દેવકી જય ।। સનાતન ધર્મકી જય

શાન્તી શાન્તી શાન્તી

★

તા. ૧૬ મી ડીસેમ્બર સને ૧૯૪૩ સાંજે પાંચ વાગ્યાના સુમારથી આમંત્રીત મહેમાનો પધારવા લાગ્યા. તેમનું ગામના આગેવાન ભાઇઓ, તથા કેપ્ટનો, તથા વોલીંટીયરો વગેરે ભાઇઓએ સુંદર સ્વાગત કર્યું હતું.

સાંજના ભોજન થયા બાદ રાત્રે નવ વાગે સભા ભરવામાં આવી હતી. મંગલાચરણ થયા બાદ પ્રમુખ સાહેબ પા. હંસરાજભાઇ નારાણભાઈ, તથા સેક્રેટરી મી. કરસનભાઈ પંચાણભાઇએ પોતાનું સ્થાન લીધું હતું. ઉપ-પ્રમુખના સ્થાને ભાઇ શ્રી. નારાણભાઇ રતનશીભાઇ શાન્તીપુરા કમ્પાવાળાની સર્વાનુમતે ચુંટણી કરવામાં આવી હતી. અને તાળીઓના હર્ષનાદ વચ્ચે

realpatidar.com

https://archive.org/details/bk786/page/n9/mode/1up

realpatidar.com

તેઓએ પોતાનું સ્થાન લીધું હતું. ત્યાર પછી સભાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

સેક્રેટરી પં. કરશનભાઇ પંચાણભાઇનું ભાષણ

મહેરબાન પ્રમુખ સાહેબ તથા ઉપપ્રમુખ સાહેબ તથા પુજ્ય મહારાજ શ્રી. તથા પધારેલા સભાસદ બંધુઓ, માતાઓ અને બ્હેનો—

આપ સર્વ સજ્જનોએ પધારી અમોને કૃતાર્થ કર્યા છે, તે બદલ અમો આપના અત્યંત આભારી છીએ. આપની સેવા ઉઠાવવામાં અમારાથી કાંઇપણ ન્યુનતા રહી જાય, તો આપ સર્વ દરગુજર કરશો. આજની સભા બોલાવવાનો મુખ્ય ઉદ્દેષ એ જ છે કે, ગામ શ્રી રામપુરા કમ્પે આપણી મીટીંગ ભરાયેલી, અને તેમાં આપણી જ્ઞાતિના રીત રીવાજોના ઠરાવો ઘડાયેલા, તે આજની સભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવનાર છે. તો તે ઠરાવોમાં આપને કાંઇપણ અપૂર્ણતા જણાય, તો પોતપોતાની બુદ્ધિ અનુસાર સુધારા વધારા સૂચવશો. અને તે વિષય ઉપર ચર્ચાઓ ચલાવી તેનું સમર્થન કરી, સર્વાનુમતે પસાર કરશો, એવી આશા રાખું છું.

ત્યારબાદ પ્રમુખ સા. તથા મહારાજશ્રીને ફુલહાર કરવામાં આવ્યા હતા.

પ્રમુખ સાહેબનું ભાષણ

પૂજ્ય મહારાજશ્રી, જ્ઞાતિ બંધુઓ, ત્યા બ્હેનો,

તાજેતરમાંજ ગામ રામપુરા મધ્યે આપણી જનરલ મીટીંગ ભરાઇ હતી. અને તેમાં જ્ઞાતિ બંધારણો, તથા રીત રીવાજો ઘડયા હતા, તે આપને વીદીત છે; પરંતુ ઘણા ભાઇઓએ મને જણાવ્યું, કે આપણું કેન્દ્રસ્થાન બોરડી-ટીમ્બામાં, કે જેની અંદર બીજી મીટીંગ ભરાય-તો ઘણુંજ સારૂં છે. તો તે ઉપરથી બોરડી-ટીમ્બાવાળા ભાઇઓની મેં સંમતી મેળવી, તો તેઓએ જણાવ્યું, કે જો જ્ઞાતિ ગંગા અમારે આંગણે પધારશે, તો અમો સેવા ઉઠાવવા તૈયાર છીએ. તેઓની સહાનુભુતી મળતાંજ આમંત્રણ પત્રીકાઓ મોકલી. અને તે પ્રમાણે અત્રે એકત્રીત થવા ભાગ્યશાળી થયા છીએ. આગામી સભામાં આપણે સર્વ ભાઇઓએ મળી, જે ઠરાવો ઘડેલા તે અત્રે રજુ કરવામાં આવે છે. તેના પર વિચારણા ચલાવી, એકમતથી પસાર કરશો, તેમ હું ઇચ્છું છું. વિશેષમાં બોરડી-ટીમ્બાવાળા ભાઇઓએ જે આપણો સત્કાર કર્યો છે, તે બદલ તેઓને ધન્યવાદ છે.

realpatidar.com

https://archive.org/details/bk786/page/n10/mode/1up

realpatidar.com

ઉપપ્રમુખ નારણભાઇ રતનશીભાઇનું ભાષણ

મે. પ્રમુખ સાહેબ તથા મહારાજશ્રી, તથા માતાઓ, અને બ્હેનો,

આજની સભાના ઉપપ્રમુખ તરીકે આપ સર્વ ભાઇઓએ મળી, મને પસંદ કર્યો. તે આપની લાગણીની હું કદર કરૂં છું. પરંતુ મારાથી મોટા વડીલો નીચે બેઠેલા હોય, અને હું ઉંચે આસને બેસું તે મને યોગ્ય નથી; પરંતુ આપ વડીલોની જ્યારે આજ્ઞા છે, તો આપના માનની ખાતર જ્ઞાતિ સેવા બજાવવા હું તૈયાર છું.

બંધુઓ, આજે આપણે આપણા ધારાધોરણો નક્કી કરવા એકઠા થયા છીએ. તો જેમ આપણે આગળ વધી શકીએ તે પ્રમાણે વિચાર કરીને ઠરાવ પસાર કરવાના છે. અને તેની ખાસ જરૂર છે. જો બંધારણો નહિ રાખીએ, તો જ્ઞાતિ દિવસાનુદિવસ નીરંકુશ થઇ જશે. માટે સમય અને સંજોગોને અનુસરી સુધારા કરશો, એમ હું આશા રાખું છું.

ત્યાર બાદ ઠરાવો પર ભાઈ શ્રી વેલજીભાઈ ભાણજીભાઇ બોરડી ટીમ્બાવાળા, તથા ભાઈ શ્રી વાલજીભાઈ પ્રેમજીભાઇ રામપૂરાવાળા, તથા પા. શીવજીભાઇ સોમજીભાઇ એદલપુરવાળા, વગેરે વકતાઓએ ચર્ચાઓ કરી હતી. અને રાત્રે બાર વાગે બીજા દીવસ ઉપર સભાનું કામકાજ મુલતવી રાખી, જયનાદ વચ્ચે સભા વિસર્જન કરવામાં આવી હતી.

બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવકી જય. સનાતન ધર્મકી જય.

તા. ૧૭-૧૨-૧૯૪૩ ની કાર્યવાહી

આજે દશ વાગે સભા ભરવામાં આવી હતી. ભાઈ શ્રી. વેલજીભાઇ ભાણજીભાઇએ, મે. પ્રમુખ સાહેબ તથા ઉપપ્રમુખ સાહેબ, સેક્રેટરી સાહેબ વગેરે પોતપોતાના આસને બીરાજી સભાનો કાર્યક્રમ શરૂ કરવાની વિનંતી કરી હતી. પ્રભુપ્રાર્થના થયા બાદ, સભાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ધર્મ વિષે કેટલીક ચર્ચાઓ ચાલી હતી.

મહારાજશ્રી. દયાળદાસજીનું ભાષણ

સજ્જનો, આપ પાટીદાર જ્ઞાતિની સનાતન ધર્મ પ્રત્યેની અપ્રતિમ ભાવના જોઇ, મને અત્યંત હર્ષ થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે, કે ધર્મને હણવાથી તે આપણને હણે છે, અને ધર્મનું રક્ષણ કરવાથી, ધર્મ આપણું રક્ષણ કરે છે. માટે કદાપી ધર્મનો પ્રાણાંતે પણ ત્યાગ કરવો નહિ. દયા,

realpatidar.com

https://archive.org/details/bk786/page/n11/mode/1up

1943-12-16 -Borditimba -Kutch Kadva Patidar Gnati Sammelan (786)

realpatidar.com

ન્યાય, નિતિનું પાલન કરવું, તેનું નામ ધર્મ. દયા એ તો આપ પાટીદારો-ના વારસામાં જ ઉતરેલ છે. બંધુઓ, આ મનુષ્ય જન્મ ફરી ફરી મળતો નથી. તો તેમાં પ્રભુ ભજન કરી, આ ભવસાગર પાર ઉતરવો જોઈએ. આપ બંધુઓએ ઘણે ઠેકાણે શ્રી. ભગવાનનાં મંદીરોની પ્રતિષ્ઠાઓ કરી છે તે પ્રશંસનીય છે. વળી ગામેગામ ગ્રામ્ય શાળાઓ બંધાવી કેળવણીમાં પણ ધ્યાન આપી રહ્યા છો, તે આદરણીય છે. તેથી પણ વિશેષ ધ્યાન કેળવણી તરફ આપતા રહેશો, એવી મારી ભલામણ છે. આપ પાટીદાર જ્ઞાતિનું પરમાત્મા સદા કલ્યાણ કરે, તેવા મારા શુભ આશીર્વાદ છે.

Village level school

માસ્તર નાનજી કરશન નેત્રાવાળાનું ભાષણ

મે. સભાપતિ સાહેબ, તથા પુજ્ય જ્ઞાતિ બંધુઓ,

પુજ્ય મહારાજશ્રીએ કેળવણી વિષે જણાવ્યું, તેને હું મારો હાર્દિક ટેકો આપું છું. કેળવણી બાબતમાં આપણી જ્ઞાતિને પ્રયત્ન કરવાની ઘણી જ જરૂર છે. હજુ આપણા બાળકોને પુરતું શિક્ષણ આપી શકાતું નથી. કારણ કે આપણી ગ્રામ્યશાળાઓમાં ગુજરાતી જ શિક્ષણ અપાય છે, તે પણ પુરતું નહિ. વળી તેમાં આપણે કામના લોભથી બાળકો, બાર કે તેર વર્ષની ઉંમરના થાય, એટલે તેનો વિદ્યાભ્યાસ બંધ કરાવી, કામમાં લગાડી દઈએ છીએ. તેમ ન થતાં, તેને પૂરતો ગુજરાતી અભ્યાસ તો કરાવવો જ જોઈએ. તેની સાથે અંગ્રેજી અભ્યાસ પણ થાય તો ઘણું જ સારૂં છે. તે જો આપણી જ્ઞાતિની એકાદ બોર્ડીંગ હોય, તો આપણા બાળકો તે લાભ મેળવી શકે. માટે તે બાબતની કાંઈ તજવીજ થાય, તેમ હું ઈચ્છું છું. વિદ્યા એ મનુષ્યનું રૂપ તથા ધન છે. શાસ્ત્રમાં કહ્યું છે કે: **વિદ્યા વિહિનઃ નર પશુ.** એટલે વિદ્યા વગર મનુષ્ય પશુ સમાન છે. માટે વિદ્યા અવસ્ય આપવીજ જોઈએ. અને તેમાંજ આપણી જ્ઞાતિનો ખરો ઉદ્ધાર છે. માટે મારી વિનંતિ તરફ આપ સર્વ બંધુઓ, ખચીત લક્ષ આપો, તેવી હું આશા રાખું છું. (તાળીઓ).

ત્યાર બાદ ભાઈ શ્રી ખીમજીભાઈ શવગણભાઈ- બોરડી-ટીંમ્બાવાળા તથા પટેલ હરીભાઈ કરમશીભાઈ મોતેશરીવાળા તથા પટેલ વશરામભાઈ મેઘજીભાઈ- રાયણનો માળવાળા, તથા પટેલ શવગણભાઈ વીરજીભાઈ મોડાસાવાળા તથા પટેલ કરસનભાઈ ખેતાભાઈ દેશલવાળા, વગેરે વક્તાઓએ કેળવણી તથા ધાર્મીક વિવેચનો કર્યાં હતાં. અને બાકીનું કાર્ય

realpatidar.com

https://archive.org/details/bk786/page/n12/mode/1up

realpatidar.com

તા. ૧૮-૧૨-૧૯૪૩ ને દીવસે મુલતવી રાખી, સભા વિસર્જન કરવામાં આવી હતી.

બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવકી જય ॥ સનાતન ધર્મકી જય.

તા. ૧૮-૧૨-૧૯૪૩ નો કાર્યક્રમ

મે. પ્રમુખ સાહેબ તથા ઉપ પ્રમુખ સાહેબ તથા સેક્રેટરી સાહેબ પોતાને આસને બિરાજતાં મંગલાચરણ થયા બાદ સભાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

Dayaldasji Maharaj

મહારાજશ્રીનું ભાષણ

સુજ્ઞ મહાશયો, શ્રી ગીતામાં ભગવાને કહ્યું છે, કે મહાન પુરૂષો જેજે આચરણો કરે છે, તે જોઇને બીજા સાધારણ મનુષ્ય, પણ તેજ પ્રમાણે આચરે છે. આપણે જેવા સંસ્કારો રાખીશું, તેવાજ સંસ્કારો આપણા બાળકોમાં પણ આવશે. આપણા બાળકોને જો રામ બનાવવા માગતા હશું તો આપણે રાજા દશરથ જેવા બનવું પડશે. આપણા મહાન ધર્મગ્રંથો જેવાં કે રામાયણ, મહાભારત, કે જેની અંદર આપણી શું શું ફરજો છે, તે આપ વાંચી જુઓ. કે જેથી આપણને ખ્યાલ આવે વિશેષમાં યુવાન ભાઇઓને મારી ખાસ ભલામણ છે, કે આપણાં પોતાનાં માતપિતાઓની પૂર્ણ ભાવથી સેવા કરવી, કારણ કે સઘળાં તીર્થો તેમનાં ચર્ણોમાં વસી રહેલાં છે. એક ભજનમાં કહ્યું છે કે; ધિક્કાર એવા પુત્રને, સેવા જો ના કરે. તેનો અર્થ એવો થાય છે કે જે પુત્ર, માતાપિતાઓની સેવા કરતો નથી, તેને ધીક્કાર છે. સર્વાનુમતે જે ઠરાવો નક્કી કર્યા છે તે જોઇ હું ઘણો જ આનંદ પામ્યો છું, તેનું યથાર્થ પાલન કરવા, પ્રભુ સર્વને આત્મબળ આપો, એવી મારી પ્રભુ પ્રત્યે વંદના છે.

ઉપ-પ્રમુખ સાહેબનું ભાષણ

મે. પ્રમુખ સાહેબ તથા સભાસદ ભાઇઓ,

આપણી જ્ઞાતિમાં કન્યા વિક્રય બીલકુલ હતો નહિ. પરંતુ હાલમાં કેટલેક ઠેકાણે ખાનગીમાં કન્યા વિક્રય થવા લાગ્યો છે. તો તે અનિષ્ટ કર્મ સદંતર બંધ થાય તેનો બંદોબસ્ત થવા માટે ખાસ જરૂરીઆત છે. કારણકે કન્યા વિક્રય એ મહાન પાપ છે. તે જો આ અનિષ્ટ પ્રથા આપણી જ્ઞાતિમાં જડ ઘાલી

realpatidar.com

realpatidar.com

બેસશી તો આપણે અધોગતિમાં રહીશું માટે તેનો પૂર્ણ વિચાર કરી એ ઠરાવનું બંધારણ કરી પસાર કરવો એવી મારી દરેક પ્રત્યે નમ્ર વિનંતી છે. ત્યાર બાદ પ્રમુખસ્થાનેથી રીતરીવાજ તથા બંધારણોના ઠરાવો સર્વાનુમતે મુકરર કરી સેક્રેટરીએ રજુ કર્યા પછી વાંચી સંભળાવવામાં આવ્યા હતાઃ તે નીચે મુજબ.

ઠરાવ ૧ (ચીન્ડનું સુતક)

૧. બાળકના જન્મ પછી વૃદ્ધિના દિવસો પુરા થયે મંદિરે દર્શન કરવા જવું. પુત્રનો જન્મ હોય તો રૂ. ૦ાા યા પુત્રીનો જન્મ હોય તો રૂ. ૦। પ્રભુને ભેટ ધરી તેમનું ચર્ણામૃત લઇ પવિત્ર થવું.

૨. જન્મનાર બાળકનું પુરેપુરૂં નામ, ગામ, અટક તથા જન્મતીથી ચોપડે નોંધાવવી.

૩. કુટુંબીઓને દિવસ ૧૦ સુધી સુતક લાગે છે.

ઠરાવ ૨ (સગપણ)

૧. પુત્રની ઉંમર ૫ા વર્ષની તથા પુત્રીની ઉંમર ૩ા વર્ષની. વીત્યા બાદ સગપણ મુકરર કરવું. અને તે અરસામાં દાગીનાઓ પીના વાટે આપવાં.

૨. સગપણ નક્કી થયા પછી વર પક્ષે કન્યા પક્ષને કાંચલાં નંગ ૨ા ગોળ શેર ૧ા તથા રૂ. ૦ાા રોકડો આપવો.

૩. સગપણ મુકરર કર્યા પછી એટલે લગ્ન થયાં પહેલાં કરેલ સગપણનાં છોકરામાં કોઇ કુદરતી ખોડ રહી જાય અને તેનો છેડો છુટ કરવો હોય તો પાંચ ગામનાં પંચોએ મળી કરવો પરંતુ ગ્રામ્ય પંચાયતથી તેનો નિકાલ કરવો નહિ.

૪. દુધ પીવણામાં ઓઢણી વાર બે તથા રૂ. ૧ા રોકડો મુકવો. અને જો કન્યા પક્ષ જમણ જમાડે તો રૂ. ૧ા ને બદલ રૂ. ૪ા રોકડા વર પક્ષે આપવા.

૫. સગપણ થઇ ગયા બાદ પહેલી દિવાળીએ રૂ. ૦। અને પછીની દરેક દિવાળીએ રૂ. ૦ાૣ આપી કંઇ વળતર લેવી દેવી નહિ.

૬. પહેલી હુતાશનીમાં રૂ. ૦ાા અને પછીની દરેક હુતાશનીએ રૂ. ૦ાા રોકડો આપી કંઇ વળતર લેવી દેવી નહિ.

૭. પહેલી જન્માષ્ટમીએ રૂ. ૦। અને પછીની દરેક જન્માષ્ટમીએ

realpatidar.com

realpatidar.com

રૂા. ૦)= રોકડા આપી કાંઈ વળતર લેવીદેવી નહિ.

ઠરાવ ૩ (લગ્ન વિધિ)

૧. લગ્ન લખતી વખતે લગ્ન પડામાં કન્યા પક્ષે રૂા. ૦ાા રોકડા મુકવો અને વર પક્ષે રૂા. ૦ાા આપી લગ્ન વધાવવું.

૨. જાનમાં (વર ત્થા અણુવર સિવાય) માણસોની સંખ્યા ૨૦ ત્થા ગાડાં ૨ જઈ શકે. તે ઉપરાંત માણસોની સંખ્યા વિશેષ હોય તો માણસ દીઠ રૂા. ૧) વરપક્ષે કન્યા પક્ષવાળાને આપવા. અને ગાડાંની સંખ્યા વધારે લાવવી હોય તો પોતાને ખર્ચે લાવે.

૩. વાયણાના રૂા. ૧૨ાા આપવા ત્થા પરસુરણ લાગાના રૂા. ૩ાા કુલે દેવા. તેમાંથી રૂા. ૧ા ધર્માદામાં મુકી બાકી રૂા. ૨ા કન્યાના બાપે લેવા. આથી અગાઉ દરેક માણસ દીઠ આઠ આના લેવામાં આવતા હતા તે સદરહુ તારીખથી બંધ કર્યાં છે.

૪. ચોરીમાં વાસણો માટે પ્રજાપતિનો જે લાગો થાય તે બન્ને વેવાઈઓએ અડધોઅડધ આપવો અને ચોરીનાં વાસણો પણ અડધોઅડધ લઈ લેવાં. લગ્ન વીધી વિદ્વાન બ્રાહ્મણ પાસે કરાવવી અને તેની દક્ષિણા બન્ને વેવાઈઓએ અડધોઅડધ દેવી.

૫. પરણતી વખતનું પડલું કન્યાના બાપશ્કર તેમ સુતરાઉ આપવું અને તેની વળતરમાં વરને જોડી બદલ તેના બાપશ્કર સુતરાઉ લુગડાંઓની પુરેપુરી પહેરામણી કરવી.

૬. પડલાની છાબમાં પતાસા શેર ૨ાા વરપક્ષે આપવાં અને તેની બદલ કન્યાપક્ષે થાળી ૧) વાડકા ૧) પિત્તળના આપવાં.

૭. સદરહુ તારીખથી ૭ ૭ વર્ષના અંતરે લગ્ન કરવાં અને લગ્નના સમયથી ૭ માસ અગાઉ જ્ઞાતિની જનરલ સભા બોલાવી સર્વાનુમતે લગ્નતીથી નક્કી કરવી. કદાચ્ય તે સમયની અંદર કોઈ વર-કન્યા ઉપર કુદરતનો કોપ થાય તો તેવાંઓને છુટાં લગ્ન કરવાની છુટ છે.

૮. કન્યા પરણીને ઘેર ગયા પછી પરણેતર વાયણું ન લઈ જતાં એકજ માણસે જઈને કન્યાને તેડી લાવવી.

૯. કન્યા પરણીને જ્યારે જાનીવાસે જાય ત્યારે રૂા. ૧) રોકડો વરપક્ષે કન્યાને નમસ્કારનો આપવો.

realpatidar.com

https://archive.org/details/bk786/page/n15/mode/1up

realpatidar.com

ઠરાવ ૪ (આણેલાં સંબંધી)

૧. કન્યાની ઉંમર ચૌદ વર્ષની થાય ત્યારે સુતરાઉ પડલું મોકલવું અને પહેલું આણેલું કરવું, તેમાં આવનાર માણસની સંખ્યા ૧૦) થી વધુ ન હોવી જોઇએ. વરપક્ષે કન્યાપક્ષવાળાને રૂા. ૪) ચાર રોકડા કલદાર આપવા.

૨. કન્યાની ઉંમર ૧૫) વર્ષની થાય ત્યારે બીજું આણેલું કરવું. તેમાં આવનાર માણસની સંખ્યા ૩ થી વધુ ન હોવી જોઇએ.

૩. કન્યાની ઉંમર ૧૬ વર્ષની થાય ત્યારે જન્માષ્ટમી વિત્યા બાદ સાસરે મોકલવી. તેડવા આવનાર માણસ બે હોવાં જોઇએ.

ઠરાવ ૫ (જીયારૂં)

૧. આપણી બ્હેન દીકરીને જીયારૂં આપવા આપણે પોતાને ઘેર બોલાવી પોતાની યથાશક્તિ પહેરામણી આપી તેમને ઘેર મોકલવાં. તેવીજ રીતે જીયારા સંબંધમાં પોતાના અંગત સગાંઓએ પણ પોતાને ઘેર બોલાવી પહેરામણી આપવી.

૨. બાળકના બાપના મોસાળપક્ષને સાડલા પહેરાવવાનો રિવાજ સદરહુ તારીખથી બંધ કરવામાં આવે છે.

ઠરાવ ૬ પુનર્લગ્ન

૧. પુનર્લગ્નનો રિવાજ છે તે કાયમ રાખવામાં આવે છે.

૨. આપણી જ્ઞાતિમાં કોઇપણ સંજોગોમાં કોઇએ કન્યાવિક્રય બીલકુલ કરવો નહિ. જો કોઈ આ ઠરાવનો ભંગ કરશે અથવા કરાવશે તો તે આ સંસ્થાનો ગુનેગાર ગણાશે.

ઠરાવ ૭ (કારજ)

૧. ૪૦ વર્ષ પછીની ઉંમરમાં અવસાન પામેલ વ્યક્તિનું પરોજણ પોતાના સગાં સંબંધીઓને તેડી કરવું હોય તો તેને છૂટ છે.

૨. ૪૦ વર્ષની અંદરની ઉંમરમાં થયેલ અવસાનનું કારજ કરવું નહિ, અને કદાચ કારણવશાત તે કરવું હોય તો ગામના ભાઈઓ તથા છોકરાંઓ જમી શકશે.

ઠરાવ ૮ (ધર્માદા ભાગ્ય બંધારણ)

૧. ખેતી કરનાર દરેક વ્યક્તિએ પોતાની ઉપજ જેવીકે અનાજ, કપાસ,

realpatidar.com

https://archive.org/details/bk786/page/n16/mode/1up

realpatidar.com

તેલીબીયાં વગેરેમાંથી દર વર્ષે દર મણે શેર ૧) ધર્માદામાં આપવું તથા મજુર વર્ગમાં સારી સ્થિતિની વ્યક્તિઓએ દર વર્ષે રૂા. ૫) અને સાધારણ સ્થિતિની વ્યક્તિઓએ રૂા. ૧। ધર્માદામાં આપવો.

ઠરાવ ૯ (જ્ઞાતિસંસ્થાના ફંડ વિષે)

૧. આપણી જ્ઞાતિ સંસ્થાના ફંડમાં દર વર્ષે હળ દીઠ રૂા. ૫) દરેક ગામના આગેવાનોએ સીઝનમાં ભેગા કરી પોતાના ગામમાં સંસ્થાની કમીટીના સભ્યોને સોંપવા, તેનો હિસાબ સંસ્થા જ્યારે માગે ત્યારે સભ્યે આપવો. આ ફંડનો ઉપયોગ સંસ્થાને અનુકુળ લાગે ત્યાં કરી શકશે. અને તેનો હિસાબ સભ્યોએ સંસ્થામાંથી નોંધ લઇ પોતાના ગામના ભાઇઓને સમજાવવો.

ઠરાવ ૧૦ (વૃદ્ધ તથા અશક્ત જાનવરો માટે)

૧. આપણે ઘેર રાખેલાં ચોપગાં પ્રાણીઓ જેવાં કે બળદ, ગાય, વાછરડાં, ભેંસ, પાડાં વગેરે વૃદ્ધ તથા આપણા કામમાં ન આવે તેવાં પ્રાણીઓને પૈસાના લોભથી વધસ્થાને લઇ જાય એવી વ્યક્તિને આપવાં નહિ.

ઠરાવ ૧૧ (જન્માષ્ટમીના તહેવારો વિષે)

૧. જન્માષ્ટમીના તહેવારોમાં રાંધણછઠ, શીતળા સાતમ એ બે દિવસોમાં દિવસના ભાગમાં બાઈઓએ રાસ વગેરે ગાવાં અને જન્માષ્ટમીના દિવસે રાસ ગાવાં. તથા રાત્રે મધ્યરાત્રી સુધી (ભગવાનના જન્મોત્સવ) સુધી જાગરણ કરવું. અષ્ટમીની રાત્રી સિવાય આ તહેવારોમાં રાત્રીએ જાગરણ કરવું નહિ.

ઠરાવ ૧૨ (નવરાત્રિ ઉત્સવ)

૧. નવરાત્રીના ઉત્સવમાં ચોક વચ્ચે ગરબી પધરાવી પુજન આરતી કરી ઉત્સાહપૂર્વક માતાજીના ગરબા ગાવા, તે સિવાય સ્વાંગ નકલી નાટક કે ભવાઇ કરવી નહિ.

ઉપર લખ્યા ઠરાવોનું ઉલ્લંઘન કરનાર દરેક વ્યક્તિ આ સંસ્થાની ગુનેગાર ગણાશે. અને તેની સાથે આ સંસ્થાનો કોઇપણ સભ્ય ખાવા પીવાનો વહેવાર રાખશે તો તે પણ આ સંસ્થાનો ગુનેગાર ગણાશે, સદરહુ તારીખથી આ સંસ્થામાં આવનાર વ્યક્તિએ સતપંથી સાથેનો ખાવા પીવાનો વહેવાર સદંતર બંધ કરવો પડશે. ઉપરના ઠરાવો અમો નીચે સહીઓ કરનાર સર્વ ભાઈઓએ ક્ષત્રિયોને

સતપંથી સાથે ખાવા પીવાના વ્યવહાર સદંતર બંધ

realpatidar.com

realpatidar.com

એકઝાંપ થઈ પસાર કરેલા છે. તે ઠરાવોને શુદ્ધ હૃદયથી અને દ્દઢ મનથી પાળવા અમો તથા અમારા વંશવારસ બંધાયેલાં છીએ, તે બદલ અમોએ આ નીચે સહીઓ કરી છે.

Umiya Mataji Vandhay na prerak / motivator

પા. હરીભાઇ કરમશીભાઇનું ભાષણ

મે. પ્રમુખ સાહેબ તથા ઉપ-પ્રમુખ સાહેબ તથા પૂજ્ય જ્ઞાતિબંધુઓ,

આજે આપ સર્વ બંધુઓએ જે સુધારા વધારાના ઠરાવો સર્વાનુમતે પસાર કર્યા છે. તે જોઇ મારૂ હૃદય પ્રફુલ્લીત થયું છે. શ્રી માતાજી ઉમીયા દેવીની પૂર્ણ કૃપાથી મારો પરિશ્રમ સફળ થયો છે. અને તે આપ સર્વ બંધુઓની ધમસને આભારી છે. મેં નિશ્ચય કર્યો હતો કે આ કાર્ય નિર્વિઘ્ને પસાર થાય તો શ્રી કુળદેવી ઉમીયાજીનું મંદિર (કચ્છ) બાંધવામાં આવે તો તેની અંદર રૂા. ૧૦૦૧ આપીશ, તે આજે આ સભામાં હું જાહેર કરૂં છું કે કચ્છમાં આપણી કુળદેવીના મંદિરની ખાસ જરૂર છે. જેના માટે બીજા ભાઇઓ પણ યથાશક્તિ મદદ કરશે તેવી હું આશા રાખું છું.

ત્યારબાદ કચ્છમાં ઈશ્વરનગર (વાંઢાય)માં કુળદેવીની સ્થાપના મુકરર કરવામાં આવી અને તેના રૂા. ખરડામાં થયા હતા. તથા અંધશાળા ફંડના રૂા. તથા રીપોર્ટ છપામણી રૂા. ખરડાઓમાં આવ્યા હતા.

પા. ભીમજીભાઇ શવગણભાઇનું ભાષણ

મે. પ્રમુખ સાહેબ તથા સભાસદો,

આપ સર્વ બંધુઓના પધારવાથી અમોને દર્શનનો લાભ થયો છે. આપની સેવા ઉઠાવવામાં કાંઇ પણ ખામી હોય તો ક્ષમા કરશો. આપશ્રીએ જે તકલીફ ઉઠાવી છે તે બદલ અમો આપનો આભાર માનીએ છીએ.

પા. શીવજીભાઇ સોમજીભાઈ એદલપુરાવાળાનું ભાષણ

મે. પ્રમુખ સાહેબ તથા સભાસદો,

અત્રેની સભાનું પદ્ધતિસર અને નીખાલસ હૃદયથી જે કામકાજ થયું છે, તે જોઇ મને ઘણોજ આનંદ થયો છે. અત્રેના ભાઈઓ એ ચાર ચાર દિવસથી જ્ઞાતિસેવા બજાવવા તત્પર થયા છે, તેમને હું ઘણો જ ધન્યવાદ આપુ છું. વિશેષમાં કેપ્ટનો તથા વોલીંટીયરોએ રાત્રી દિવસ તનતોડ મહેનતે ખડે પગે સેવા બજાવી

realpatidar.com

https://archive.org/details/bk786/page/n18/mode/1up

realpatidar.com

તે બદલ તેમને હજારોવાર ધન્યવાદ છે. તેવીજ રીતે દરેક યુવાનોએ જ્ઞાતિ સેવામાં મગ્ન રહેવું એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરું છું.

કેપ્ટન નં. ૨ પા. માવજીભાઇ લાલજીભાઈનું ભાષણ

પૂજ્ય મુરબ્બીઓ, અમો વોલીંટીયરો તરફથી આપની સેવામાં કોઇ પણ જાતની ખામી આવી હોય તો તે બદલ અમારી પાર્ટી તરફથી હું આપની પાસે ક્ષમા યાચું છું.

પા. વાલજીભાઇ શવગણભાઈનું ભાષણ

ગદ્ ગદ્ કંઠે બોલતાં જણાવ્યું કે પુજ્ય મુરબ્બીઓ, હું વોલીંટીયર નં. ૨ માં નીમાયો હતો. પરંતુ મારા કમભાગ્યે એકજ દિવસ આપની સેવાનો લાભ ઉઠાવી શક્યો. અને બીજે દિવસે તાવ આવવાથી હું આપની સેવા બજાવવા નિષ્ફળ નિવડયો. મારે ઘણીજ ઉમેદ હતી કે હું મારાથી બનતી સેવા ખરા અંતઃકરણથી બજાવીશ પણ લાચાર કે તે બાબતનો લાભ મેળવી શકાયો નહિ. વિશેષમાં મારી તબીયત નરમ હોવાને લીધે વધારે વિવેચન કરવા લાચાર છું; માટે આપ સર્વ ક્ષમા કરશો.

પા. ભાણજીભાઇ કરસનભાઈ-ગામ રામપુરાવાળાનું ભાષણ

મહેરબાન પ્રમુખ સાહેબ તથા સભાસદો,

ભાઇશ્રી વાલજીભાઇએ જે ભાષણ આપેલ તેને હું અનુમોદન આપતાં કહું છું કે આપે જે જ્ઞાતિસેવા કરવાની સાચા હૃદયની ધગશ બતાવી છે તે માટે તમોને ધન્યવાદ આપું છું. વિશેષમાં બીજા વોલીંટીયરોએ જે સેવા બજાવી છે તે તમોએ જ બજાવી છે. ઇશ્વર આપની તબીયત તાત્કાલીક ક્ષેમકુશળતામાં રાખે એવી મારી અંતરની પ્રાર્થના છે.

પા. કરસનભાઇ ખેતાભાઇ ડેરોલવાળાનું ભાષણ

પૂ. જ્ઞાતિબંધુઓ, માતાઓ તથા બહેનો !

આપણા આચાર વિચારમાં પણ ઘણી જ ખામી જણાય છે. તો દરેક ભાઇઓએ પ્રથમ પોતાના ઘરમાં આચાર વિચાર શુદ્ધ રાખી પછી આપણા બીજા ભાઇઓને પણ તેનું રહસ્ય સમજાવવું. કારણ કે **આચારો પ્રથમો ધર્મ** એટલે પહેલો ધર્મ આચારો શુદ્ધ રાખવાં. વિશેષમાં આપણે ઘેર બ્રાહ્મણ, સાધુ, સંત આવે તો તેને આપણી યથા-શક્તિથી પુન્યદાન કરવું એ ગૃહસ્થાશ્રમનો ધર્મ છે. માટે મારા બે બોલ ઉપર આપ સર્વ લક્ષ આપશો એવી હું આશા રાખું છું.

realpatidar.com

https://archive.org/details/bk786/page/n19/mode/1up

realpatidar.com

પા. રામજીભાઇ વાલજીભાઇનું ભાષણ

પૂજ્ય જ્ઞાતિબંધુઓ, માતાઓ તથા બહેનો ! આજ અમારા ધન્યભાગ્ય કે આપ જ્ઞાતિગંગા અમારે આંગણે પધારી અમોને પાવન કર્યાં છે. આપનાં પવિત્ર દર્શનથી અમારા હ્રદયસાગરમાં હર્ષનાં મોઝાંઓ ઉછળી રહ્યાં છે. વિશેષમાં આપની સેવા કરવા સંબંધમાં કાંઇ ખામી હોય તો તે બાબતોની અમો ક્ષમા માગીએ છીએ. મારા ભાઈઓ વોલીંટીયરોએ જે તનમનથી સેવાઓ બજાવી છે તેમનો હું મોટો આભાર માનું છું.

પા. ગંગદાસભાઈ નાનજીભાઇનું ભાષણ

મે. પ્રમુખ સાહેબ તથા સભાસદો, આપણી જ્ઞાતિગંગા અમારે આંગણે પધારી જેમ સોનાનો સૂર્ય ઉદય થાય તેવીજ રીતે અમારા ગામનો ઉદય થયો છે. આપણી જ્ઞાતિ ઉન્નતિના શીખરે પહોંચી સનાતન ધર્મનો વિજયધ્વજ ફરકી રહ્યો છે, તે શ્રી લક્ષ્મીનારાયણના પ્રતાપથી. વિશેષમાં પૂજ્ય મહાત્મા શ્રી ઓદ્ધવરામજીની અમીદ્રષ્ટિથી આપણી જ્ઞાતિમાં દીન-પ્રતિદિન ઉન્નતી થતી જાય એવી મારી પ્રભુ પાસે પ્રાર્થના છે.

Closing Summary

ઉપસંહાર

સજ્જનો ! આપણે જે કાર્ય માટે એકત્ર થયા હતા તે ઇશ્વરની કૃપાથી નીર્વીઘ્ને પરિપૂર્ણ થયું છે. જે નિખાલસ હ્રદયથી આપે સહકાર આપ્યો છે તેવી રીતે હરહંમેશા સહકાર આપતા રહેશો. આપણે પસાર કરેલા ઠરાવોનું શીસ્તપૂર્વક પાલન કરશો. વિશેષમાં આપણા જે ભાઈઓ અત્રે હાજર ન હોય તેને વાંચી-વંચાવી-સમજાવી આપણું સંઘબળ વધારવાની કોશીષો કરતા રહો એવી હું આશા રાખું છું.

પૂજ્ય મહારાજ શ્રી દયાળદાસજી અત્યંત પરિશ્રમ વેઠી આપણી જ્ઞાતિ ઉન્નતિ માટે અથાગ લાગણી ધરાવી રહ્યા છે તે બદલ આપણી જ્ઞાતિ સદાને માટે ઋણી છે, અને તેમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. બોરડી ટીમ્બાવાળા ભાઇઓએ પણ જે જ્ઞાતિસેવા તન, મન, ધનથી બજાવી છે તેઓને માટે પણ ધન્યવાદ છે. અત્રેનું તમામ ખર્ચ જ્ઞાતિ ફંડમાંથી ન લેતાં બોરડીટીંમ્બાવાળા ભાઇઓએ શીર ઉપર લીધેલ છે, તો તેઓને પણ હજારોવાર ધન્યવાદ છે. કેપ્ટનો તથા વોલીંટીયરોએ જે અપાર સેવા બજાવી છે તે સંબંધમાં જેટલો ધન્યવાદ આપી શકાય તેટલો ઓછો છે. દરેક પધારેલા ભાઈઓનો અમો હાર્દીક આભાર માનીએ

realpatidar.com

https://archive.org/details/bk786/page/n20/mode/1up

realpatidar.com

છીએ. પરમ્ કૃપાળુ પરમાત્મા આપણને સદ્‌બુદ્ધિ આપે અને આપણી જ્ઞાતિનો ઉદ્ધાર થાય તેવી પ્રાર્થના છે. આપણી મીટીંગોનો અહેવાલ છપાઇ બહાર પડે તો સુંદર પ્રચારકાર્ય થાય તેવી દરેક ભાઇઓની માગણી છે. અને તેનું ફંડ પણ એકઠું થઈ ગયું છે. તો આ સભાનો અહેવાલ છપાવવાની મંજુરી આપે છે.

આજની સભાનો કાર્યક્રમ સંપૂર્ણ થયેલો છે તો સભા વિસર્જન કરવામાં આવે છે. ત્યારબાદ સ્તુતિ થયા પછી શ્રી લક્ષ્મીનારાયણ તથા કુળદેવી ઉમીયાજી માતાના જયના હર્ષનાદો સાથે સભા વિસર્જન કરવામાં આવી હતી.

બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવકી જય

શાન્તિ શાન્તિ શાન્તિ

★

॥ ૐ ॥

શ્રી બોરડી ટીમ્બા ગ્રામ્ય સભાનો અહેવાલ

તા. ૧૯-૧૨-૧૯૪૩ ની રાત્રે નવ વાગે સભા ભરવામાં આવી હતી, જેમાં ગામવાસી ભાઇઓ તથા બહેનોએ સારા પ્રમાણમાં હાજરી આપી હતી. રહી ગયેલા મહેમાનો પણ સભામાં પધાર્યા હતા. શરૂઆતમાં પ્રભુ-પ્રાર્થના બાદ ભાઇશ્રી કરસન પંચાણે ગ્રામ્ય સભાના પ્રમુખ વેલજીભાઇ ભાણજી-ભાઇ તથા સેક્રેટરી ખીમજીભાઇ શવગણભાઇને પોતાના આસને બિરાજવાની દરખાસ્ત મૂકી હતી. જેને પ્રેક્ષકવર્ગે સહર્ષ વધાવી લીધી હતી. અને તાળીઓના હર્ષનાદ સાથે પ્રમુખ તથા સેક્રેટરીએ પોતાનાં આસન શોભાવ્યાં હતાં.

પ્રમુખ સાહેબ વેલજીભાઇનું ભાષણ

બંધુઓ, માતાઓ તથા બહેનો, આજની સભા યોજવાનો મુખ્ય ઉદ્દેશ એજ કે આપણાં ગામના યુવક બંધુઓએ વોલીંટીયર તરીકેની પોતાની ફરજો સંપૂર્ણપણે બજાવી અને જ્ઞાતિબંધુઓનો સત્કાર કરવામાં વિનય અને વિવેકથી સંપૂર્ણ યશ મેળવ્યો છે, તેઓને ધન્યવાદ છે. રાત્રિ દિવસ પરિશ્રમ વેઠી અથાગ જહેમત ઉઠાવી આપણા ગામને જે માન અને યશ આપ્યાં છે, તે બદલ તેમની કદર કરી ફુલ નહિ તો ફુલની પાંખડી રૂપ

realpatidar.com

https://archive.org/details/bk786/page/n21/mode/1up

realpatidar.com

અલ્પભેટ ગામ તરફથી દરેક વોલીંટીયર બંધુઓને એક એક રૂપીઓ ભેટ આપવામાં આવે છે. મને આશા છે કે દરેક વોલીંટીયર બંધુઓ તેનો સહર્ષ સ્વીકાર કરશે.

ત્યારબાદ દરેક વોલીંટીયર બંધુઓને મળીને કુલે રૂપીઆ ૩૪ ની અલ્પ ભેટની વ્હાટણી કરવામાં આવી હતી.

કેપ્ટન માવજી લાલજીનું ભાષણ

મે. પ્રમુખ સાહેબ તથા વડીલ બંધુઓ, માતાઓ, તથા બ્હેનો, આપ વડીલોએ અમારી સેવાની કદર કરી જે ભેટ આપી છે તે બદલ દરેક વોલીંટીયર બંધુઓ તરફથી હું આપનો આભાર માનું છું. વિશેષમાં અમોએ અમારી ફરજથી કાંઇપણ વિશેષ કર્યું નથી. દરેક યુવકની ફરજ છે કે પોતાના વડીલોની સેવા કરવી. તો આતો જ્ઞાતિ ગંગા આપણે આંગણે પધારી તેની સેવા ન કરીએ તો અમારા હતભાગ્ય ગણાય; આપ વડીલોની આજ્ઞા શીરોમાન્ય કરવી તે અમારી પ્રથમ ફરજ છે. આ જગતમાં જન્મ લઇ જેણે પોતાના દેશની કે જ્ઞાતિની સેવા નથી કરી તેવા અભાગીઓને ધિક્કાર છે. અમોને આપેલ ભેટ લેવા અમોને અધિકાર નથી; છતાં આપ વડીલોના માનની ખાતર તેનો આભાર સાથે સ્વીકાર કરીએ છીએ. અને જ્યારે જ્યારે ને જ્યાં જ્યાં અમારી સેવાની જરૂર પડે ત્યારે આપ વડીલોની આજ્ઞા પાળવા સર્વ તૈયાર છીએ.

સેક્રેટરી મી. ખીમજીભાઇ રાવજીભાઇનું ભાષણ

આપણા ગામના માસ્તર સાહેબ નાનજીભાઇ કરશનદાસ પટેલ રહીશ કચ્છ નેત્રાવાળાએ જે રાત્રી દિવસ મહેનત ઉઠાવી જનરલ મીટીંગનો કાર્યક્રમ લખવામાં તથા રિવાજોના બંધારણોમાં જે અથાગ બુદ્ધિનો સંપૂર્ણ રીતે ભોગ આપ્યો છે, તે બદલ તેમની કદર કરી રૂ. ૭) ગામ તરફથી ન્યુન્તા ભેટ આપવામાં આવે છે. જેનો તેઓશ્રી સ્વીકાર કરે એવી હું એમના પ્રત્યે આશા રાખું છું.

માસ્તર સાહેબ નાનજીભાઇ કરશનદાસનું ભાષણ

મહેરબાન પ્રમુખ સાહેબ તથા માનદ મંત્રી સાહેબ તથા પૂજ્ય મહારાજશ્રી તથા વડીલ બંધુઓ, માતાઓ તથા બ્હેનો, આપશ્રીએ મારી અલ્પબુદ્ધિની કદર કરી મને જે માન આપ્યું તે બદલ હું આપનો મારા ખરા અંતઃકરણપૂર્વકથી આભાર માનું છું. મહાશયો, હું પણ આપનો જ

realpatidar.com

https://archive.org/details/bk786/page/n22/mode/1up

realpatidar.com

જ્ઞાતિબંધુ છું. જે આપની જ્ઞાતિ છે તેજ મારી પણ પૂજ્ય જ્ઞાતિમાતા છે. જેટલો આપને સેવાનો હક્ક તેટલો જ મને પણ છે. તો મેં જે સેવા બજાવી તેમાં કંઈ નવીનતા કરી નથી. જ્ઞાતિની સેવા કરવી એ મહાન ફરજ છે. કોઈ તનથી કરે, કોઈ મનથી કરે, કોઈ ધનથી પણ કરે છે. એ વાક્યોના અનુસારે આપ તરફથી જે ભેટ આપવામાં આવે છે તે લેવાને હું યોગ્ય નથી; પરંતુ આપ મારા વડિલ છો એટલે આપની આજ્ઞાને માન આપી આપની અલ્પ ભેટનો સ્વીકાર કરૂં છું.

ત્યારબાદ સેક્રેટરી સાહેબે જણાવ્યું હતું કે ડેરોલ કમ્પાના માસ્તર સાહેબ નાથાલાલભાઈએ પણ પોતાના કીંમતી વખતનો ભોગ આપી જનરલ મીટીંગનો અહેવાલ લખવામાં જે પરિશ્રમ ઉઠાવ્યો છે તે બદલ તેમને રૂા. ૬) ભેટ આપવામાં આવે છે.

માસ્તર સાહેબ નાથાલાલભાઈનું ભાષણ

મે. પ્રમુખ સાહેબ તથા સજ્જનો અને માતાઓ, આપની મીટીંગમાં હાજર રહેવા બદલ મારા ભાગ્યને ધન્ય માનું છું. આપ પાટીદાર જ્ઞાતિનો ભાગ્યોદય જોઈ મને અત્યંત હર્ષ થયો છે. આપને ઉન્નતિના શિખરે પહોંચેલા જોઈ મારૂં હૃદય પ્રફુલ્લિત થયું છે. આપની જ્ઞાતિનો સોનેરી સૂર્ય સંપૂર્ણ કળાએ પ્રકાશિત થઈ અઘોર અજ્ઞાનરૂપી તિમિર નષ્ટ કરે એવો મારો શુભ આશીર્વાદ છે. વિશેષમાં સનાતન ધર્મની સિંહ-ગર્જનાથી વિજયવાવટો ચાર બાજુએ ફરકી આપની જ્ઞાતિની ઉન્નતિ દીનપ્રતિદીન ચઢતીમાં જાય એવી મારી પરમાત્મા પાસે વારંવાર પ્રાર્થના છે.

પા. શામજીભાઈ હરજીભાઈનું ભાષણ

મહેરબાન પ્રમુખ સાહેબ તથા સજ્જનો,

આપના પ્રીય યુવક બંધુઓએ વડીલોની આજ્ઞા ઉઠાવી જ્ઞાતિ સેવા બજાવી છે. તે ઇતિહાસમાં સૂવર્ણાક્ષરે લખાશે. હું અપીલ કરૂં છું કે જેમ મીલીટરી સિપાઈઓ પોતાના સરદારને વફાદાર રહી હુકમ ઉઠાવે છે તેમ તમો પણ મીલીટરી માફક પોતાના ઉપરીનો હુકમ બજાવશો તો તમારો સદાને માટે વિજય છે એમ ખાતરીથી માનજો. વિશેષમાં તમોએ ઉઠાવેલ અજોડ સેવા બદલ હું આપને મારા હૃદય ને લાગણી ધરાવી વારંવાર ધન્યવાદ આપું છું.

realpatidar.com

https://archive.org/details/bk786/page/n23/mode/1up

realpatidar.com

પા. શીવજીભાઇ પ્રેમજીભાઈનું ભાષણ

મહેરબાન પ્રમુખ સાહેબ તથા સર્વ સભાસદો,

અમારા યુવક મંડળને અમારા વડીલ શ્રી. શામજીભાઇ હરજીભાઇએ જે મીલીટરી તરીકેની ઉપમા આપી છે, તેનો અર્થ એ થાય છે કે યુવાન વર્ગોએ સંગઠનમાં રહેવું અને વડીલોની આજ્ઞા પાળવા તત્પર રહેવું. તો તે સંબંધમાં મારી પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે કે તેવી પ્રેરણાઓ અમારા હૃદયની અંદરમાં વાસ કરતી જ રહે.

પા. રાજારામભાઇ ડાહ્યાભાઇનું ભાષણ

મહેરબાન પ્રમુખ સાહેબ તથા બંધુઓ,

જેવી રીતે આપણા ગામની આજની સભા ભરાઇ છે તેવીજ રીતે મહીને યા ૭ મહીને જો સભા ભરાતી રહેશે તો ધર્મનો ઘણો પ્રચાર થાય અને દરેકને કેળવણી પણ મળી શકે.

કરસનભાઈ પંચાણભાઈનું ભાષણ

મહેરબાન પ્રમુખ સાહેબ તથા સર્વ સભાસદો,

ભાઇશ્રી રાજારામે જે દરખાસ્ત મુકી તેને હું ટેકો આપું છું. જો દરેક મહીને આપણા ગામની સભા ભરાય તો દરેક પોતાના ધાર્મિક વિચારો જણાવી શકે અને તેમાં માતાઓ તથા બ્હેનો પણ હાજરી આપે તો આપણા આચાર વિચારમાં પણ કંઇ ખામી હોય તો તે સુધરી શકે છે. અને ગામમાં કુસંપ જેવું જણાય તો પણ દૂર થાય છે. માટે દરેક વ્યક્તિએ પોતાના હૃદયની અંદર વેર ઝેર કહાડી શુદ્ધ વાક્યોથી એક બીજાના ગુણદોષ જાહેર કરે અને તેનું નિવારણ થાય માટે દરેક માસે સભા ભરવી. ત્યાર બાદ સર્વાનુમતે પ્રમુખસ્થાનેથી દરેક માસની વદી ૧૪ની રાત્રે સભા ભરવી એવું જાહેર કરવામાં આવ્યું હતું.

પા. નારાણભાઈ રતનશીભાઈ શાન્તીપુરાવાળાનું ભાષણ

મે. પ્રમુખ સાહેબ તથા જ્ઞાતિબંધુઓ !

આપના ગામના સદ્‌વિચારો જાણી મને ઘણોજ આનંદ થયો છે. માતાઓ પણ ધાર્મિક વિષયમાં ઠીક ભાગ લઇ રહ્યાં છે તે વખાણવા યોગ્ય છે. ખરેખર બાળકોને કેળવવામાં માતાનો પહેલો હિસ્સો છે. જેની માતા સદ્‌ગુણી હોય છે તેનાં બાળકો પણ સદ્‌ગુણી નીવડે છે. આપના ધાર્મિક રીતરીવાજો ધન્યવાદને પાત્ર છે.

realpatidar.com

https://archive.org/details/bk786/page/n24/mode/1up

realpatidar.com

પા. કરસનભાઈ કાનજીભાઈનું ભાષણ

મહેરબાન પ્રમુખ સાહેબ તથા સભાસદો,

આપણા ગામની અંદર એક નાની લાયબ્રેરી થાવ એવી મારી પ્રમુખ સાહેબ પાસે માગણી છે. કારણ કે ગરીબ નાનાં બાળકો તથા યુવાન વર્ગ; પુસ્તકો વાંચી તેનો લાભ મેળવી આગળ વધી શકે છે.

પ્રમુખ સાહેબ વેલજીભાઇ ભાણજીભાઈનું ભાષણ

સર્વ બંધુઓ, માતાઓ તથા બેનો, કરસનભાઈએ લાયબ્રેરી બાબતની માગણી કરી તે સંબંધમાં હું તેમને પુરતો ટેકો આપું છું. અને તે માટે તેના ફંડમાં રૂા. ૨૫) આપું છું. ત્યારબાદ રાજારામભાઇએ રૂા. ૫) તથા શામજીભાઈએ રૂા. ૫) પંચાણભાઈએ રૂા. ૨૫) વગેરે કુલ રૂા. ૬૦) નો ખરડો થયો હતો. વિશેષમાં યુવાનવર્ગો પાસે મારી વિનંતિ છે કે લાયબ્રેરીની વ્યવસ્થા તમારે કરવી અને તેની અંદર પુસ્તકોની માવજત તથા સારૂં વાંચન વાંચી તેનો સદુપયોગ કરવો યાં કરાવવો અને સારૂં શિક્ષણ મેળવીને યશસ્વી બનો એવી મારી દરેક પ્રત્યે સ્નેહભાવની લાગણી છે. વિશેષમાં આ બાબત ઉપર આપણા ગામના આગેવાન સર્વ ભાઇઓ તરફથી પણ સારો ટેકો મળશે. આજની સભાનો ટાઇમ વિશેષ થયો હોવાને લીધે બાકીનો કાર્યક્રમ આવતા માસની વદ ૧૪ ની રાત્રે મુલતવી રાખી આજની સભા વિસર્જન કરવામાં આવે છે.

બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવકી જય.

★

શ્રી ૐ તા. ૨૨-૧૨-૧૯૪૩

પુ. પા. શ્રી. દયાળદાસજી, સ્થળ: માધવપુરા (મંદિર)

સજ્જનો, પાટીદાર જ્ઞાતિની દિવસાનુંદિવસ ઉન્નતિ થતી જોઇ હું ઘણોજ પ્રસન્ન થયો છું. ચાલુ માસમાં આપણી જ્ઞાતિની બે મીટીંગો થઈ હતી. તેમાં આપણી જ્ઞાતિના જે ઠરાવો ઘડાયા છે તે આજે વાંચી સંભળાવવામાં આવશે. બોરડીટીંબાની સભામાં અત્રેના શ્રી. પા. વાલજીભાઇ ભાણજીભાઈ આવેલ અને ત્યાંની સભાનું કામકાજ જોઇ તેઓને ઘણો આનંદ થયેલો તેથી તેઓએ બોરડીટીંબા વિજયમંડળને પોતાને ત્યાં પધારવા આમંત્રણ આપ્યું હતું; તેથી ઉપર જણાવેલ તારીખે આમંત્રીત ભાઇઓ આવ્યા. તેમનું ગામ તરફથી સુંદર સ્વાગત કરવામાં આવ્યું છે.

realpatidar.com

https://archive.org/details/bk786/page/n25/mode/1up

realpatidar.com

ત્યારબાદ અત્રે એક નાની મીટીંગ થાય એવી દરેક ભાઇઓની તથા ગામની ઇચ્છા હોવાથી મીટીંગ ભરવામાં આવનાર છે, તે તેના પ્રમુખશ્રી તથા સેક્રેટરીની નીમણુંક કરવી જોઇએ.

ખીમજીભાઇ શવગણભાઈ બોરડીટીમ્બા

આજની નાની મીટીંગના પ્રમુખશ્રી તરીકે શ્રી. પા. વાલજીભાઇ ભાણજીભાઇ તથા સેક્રેટરી તરીકે શ્રી. પા. વશરામભાઇ શીવજીભાઇની સર્વાનુમતે ચુંટણી કરવામાં આવે છે. અને પ્રભુ પ્રાર્થના થયા બાદ તેઓશ્રી પોતાનું સ્થાન લે એવી હું તેમને વિનંતિ કરૂં છું.

ત્યારબાદ પ્રમુખશ્રી તથા સેક્રેટરીશ્રી પોતાના સ્થાને બિરાજ્યા ત્યારે પુષ્પ તથા તાળીઓના અવાજથી તેઓને સહર્ષથી વધાવવામાં આવ્યા અને પ્રભુપ્રાર્થના થયા બાદ સભાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

પ્રમુખશ્રી વાલજીભાઇ ભાણજીભાઈ

અત્રે પધારેલા સર્વ ભાઇઓએ જે પદને હું લાયક નથી છતાં તે પદે મારી નીમણુંક કરી તે બદલ તેમનો હું આભાર માનું છું.

પુ. પા. દયાળદાસજી

ગામ શ્રી બોરડીટીંમ્બામાં જનરલ મીટીંગ ભરાઇ ને સર્વાનુમતે ઠરાવો પસાર કરેલા છે. તે વાંચી સંભળાવવામાં આવશે તેમાં કોઇને કોઇ પણ પ્રકારનો સંશય હોય તો પ્રમુખશ્રી આગળ આવી સંશય જાહેર કરવો જેથી તેનો ખુલાસો કરવામાં આવશે. વિશેષમાં પ્રમુખશ્રીને ઇશ્વરતુલ્ય સમજી તેમની આજ્ઞાનું પાલન કરવું એ દરેક ભાઇઓની ફરજ છે. તે અદા કરશોજી.

સેક્રેટરી વશરામભાઇ

આપણી જ્ઞાતિના ગામ શ્રી બોરડીટીમ્બામાં સભા ભરવામાં આવી તેમાં હું આવી ન શકયો કારણ કે તે દિવસે મારે અણુચંતવ્યું કામ આવી પડયું હતું. હું એમ ધારતો હતો કે સભા બીજે દીવસે વિસર્જન થશે, એમ ધારી ત્રણ ચાર દીવસ સભા રહી છતાં મારાં કમભાગ્યે તેનો લાભ મેળવી શકયો નહિ તે બદલ હું દીલગીર છું.

પા. શવગણભાઈ વાલજીભાઈ

ભાઇશ્રી વશરામભાઇની વાતને અનુમોદન આપતાં જણાવું છું કે બોરડીટીમ્બામાં સભા ભરાઈ તે દીવસે તેમને ઘણું જ અગત્યનું કામ આવ્યું હતું જેથી તેમનાથી હાજરી આપી શકાય નહિ.

realpatidar.com

https://archive.org/details/bk786/page/n26/mode/1up

realpatidar.com

ત્યારબાદ ઠરાવોની નકલ તથા સુધારા વધારા જે કરેલા હતા તે ચોખવટથી વાંચી સંભળાવવામાં આવ્યા તથા પ્રમુખશ્રી તરફથી ગામના ભાઈઓ તથા બ્હેનો દરેક ઠરાવોનું બરોબર પાલન કરવું પડશે તેવી કડક સુચના અપાઇ હતી.

શ્રી. પા. કેરશનભાઇ વાલજીભાઈ

આપ સર્વે ભાઈઓએ અત્રે પધારી અમોને ઘણુંજ આભારી કર્યા છે. અને અમોને જનરલ મીટીંગમાં થયેલા ઠરાવો સંપૂર્ણ વિવેચન સાથે વાંચી સંભળાવ્યા છે. વિશેષમાં ધાર્મીક ચર્ચાઓ કરી તથા તેમનું કેવી રીતે પાલન કરવું તે સંબંધમાં જે જે ખુલાસા કર્યા અને અમો દરેક ભાઇઓ તથા બ્હેનો વગેરેને સંપૂર્ણ વાંચી સંભળાવ્યા તે બદલ અમો આપનો ઘણો જ પાડ માનીએ છીએ.

શ્રી. પા. રામજી વાલજી ગઢશીશા [કચ્છ]

આજથી અગાઉ કોઇપણ સભાની અંદર હું બોલેલ નથી જેથી મારા બોલવામાં ફેરફાર થાય અગર ખામી જણાય તો દરેક ભાઇઓ દરગુજર કરશો. આજે માધવપુરામાં આપણી જ્ઞાતિની જે ઉન્નતિ જોઇ રહ્યો છું, તેથી મને ઘણો જ આનંદ થાય છે. અમારે ગઢશીશામાં કડવા પાટીદાર મંડળ પાંચ સાત વર્ષથી નિસહાય, અસહ્ય સંકટો જ્ઞાતિ સુધારા માટે વેઠી રહ્યા છે. માટે જ્ઞાતિહીત માટે અનેક સંકટો પડે પરંતુ પગભર રહેશો તો જરૂર તેનું સારૂં પરિણામ આવશે એવી પ્રભુ પ્રત્યે મારી પ્રાર્થના છે.

પ્રમુખ સાહેબનું ભાષણ

આજની સભાનો ટાઇમ ઘણો જ વ્યતિત થયો હોવાથી બાકીનું કામકાજ આવતી કાલ માટે મુલતવી રાખી આજની સભા વિસર્જન કરવામાં આવે છે.

બોલો શ્રી. લક્ષ્મીનારાયણ દેવકી જય.

તા. ૨૩-૧૨-૧૯૪૩

★

ઇશ્વર પ્રાર્થના.

ગામ માધવ. સ્થળ મંદીર.

સવારના નવેક વાગે સભાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. શ્રી. પ્રમુખ સાહેબ તથા સેક્રેટરી સાહેબ દરખાસ્ત મુકતાં પોતાને સ્થાને

realpatidar.com

https://archive.org/details/bk786/page/n27/mode/1up

realpatidar.com

બિરાજ્યા. ત્યાર બાદ કેટલાક ભાઈઓની સંમતીથી શ્રી. પા. ધનજીભાઈ ભીમજીભાઈની ઉપ-પ્રમુખપદે સર્વાનુમતે ચુંટણી કરવામાં આવતાં તેઓએ પોતાનું સ્થાન સ્વીકારી લીધું ત્યાર પછી બોરડી ટીમ્બા વિજય મંડળના યુવકો તરફથી સારૂં મંગળાચર્ણું ગાવામાં આવ્યું હતું.

શ્રી પા. વશરામભાઈનું ભાષણ

જ્ઞાતિ ઉન્નતીના જે માર્ગો સુચવવામાં આવે તેનો સ્વીકાર દરેકે કરવો જોઈએ અને તેનું પાલન પણ અવશ્ય કરવું જોઈએ તથા આપણા ગામના યુવક મંડળ કહેવામાં આવે છે કે બોરડી ટીંમ્બા વિજય મંડળના યુવકો જ્ઞાતિ હીતના માટે કેટલી પ્રવૃત્તિ કરી રહ્યા છે. તે પ્રમાણે આપણે પણ કરવું જોઈએ. જ્ઞાતિ સેવાઓ કેવી રીતે બજાવવી તે ખાસ તેઓની પાસેથી સુચનાઓ મેળવવી જોઈએ. અમો વિજય મંડળ દરેક સુધારા તેમજ મંડળને સાનુકુળ છીએ. તે બદલ હું જનરલ મીટીંગમાં જે પ્રમાણે સહીઓ થઈ છે તે પ્રમાણે હું આજની સભાની અંદર મારી તેમની અંદર સહી કરી આપું છું તેમજ બીજા મંડળ બહારના ભાઈઓને સમજાવી સંગઠન વધારવાની આશા રાખું છું. તે આશા જરૂર પરમાત્મા પુરી કરશે.

પા. વાલજીભાઈ શવગણનું ભાષણ

મોટી સભાના કાયદા તથા ધારા ધોરણો સમજાવી તેના કડક પાલનની હકીકત અમોને તથા અમારા કુટુંબીઓને સમજાવવામાં આવતાં અમો આ મંડળના ઠરાવોનું અમારા ઈષ્ટ દેવ તથા ઉમીયા માતાજી તથા આપણું ધર્મ પુસ્તક શ્રીમદ્ ભગવદ્ ગીતા સમક્ષ પાલન કરવા બંધાઈએ છીએ અને અમો પાળીશું તેમજ બીજા પાસે પળાવીશું તે બદલ અમો નીચે સહીઓ આપીએ છીએ.

પા. કેશરા વાલજી વાડીયા

અત્રે પધારેલા ગામ બોરડી ટીંમ્બાના તથા બીજા અન્ય ગામના ભાઈઓ, અને બ્હેનો તથા માતાઓ બેઠેલાં છે તેનો અમો અંતઃકરણ-પૂર્વક આભાર માનીએ છીએ કારણ કે સ્વજ્ઞાતિ ભાઈઓના ઉદ્ધાર માટે પોતાનાં ઘરકામ છોડી જે તકલીફ ઉઠાવી છે, તે બદલ અમો આભાર માનીએ છીએ.

શ્રી. પા. શામજી નાનજી વાડીયાનું ભાષણ

શ્રી. પૂજ્ય મહાત્માજી તથા મંગારવરૂપ જ્ઞાતિ બંધુઓ તથા બ્હેનો,

realpatidar.com

https://archive.org/details/bk786/page/n28/mode/1up

realpatidar.com

આજ અમારા ગામમાં પધારી અમોને પાવન કર્યાં તે બદલ અમો આપનો આભાર માનીએ છીએ. વિશેષમાં અમારા યુવક મંડળની કાંઇ ભૂલ થઇ હોય તો જેમ, માતા પિતા પોતાના બાળકોના દોષો ન જોતાં ક્ષમા કરે છે તેવી જ રીતે અમોને આપ સર્વે મળી દરગુજર કરવા કૃપા કરશોજી.

શ્રી. પા. વસરામભાઇ શીવજીભાઇનું ભાષણ

અમારા વડીલ શ્રી. વાલજીભાઇ ભાણજીભાઈએ બોરડીટીમ્બા વિજય મંડળને અત્રે ભજન કીર્તન કરવા બોલાવ્યા હતા. તેમાં પેટા કમીટી ભરી જ્ઞાતિ સુધારા વિષે ચર્ચાઓ કરી તથા કરાવી તે બદલ હું તેમનો આભાર માનું છું.

બોરડીટીમ્બા વિજય મંડળ તરફથી

ભાઇ શ્રી. વસરામભાઇએ જે આભારદર્શન કર્યું તેને વિજય યુવક મંડળ તરફથી પા. ગંગદાસભાઇ નાનજીભાઇએ ટેકો આપ્યો હતો અને વિશેષમાં અમારા યુવક મંડળની જ્ઞાતિસેવા માટે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમો તન, મનથી તેમ સંપૂર્ણ ઉત્સાહથી સેવા કરીશું અને તે લાભ અપાવી અમારાં મંડળને આભારી કરશોજી.

ઉપસંહાર

આજની સભામાં શુભ હાજરી આપનાર સર્વ સભાસદોને મારી નમ્ર વિનંતી છે કે ગામશ્રી બોરડીટીમ્બાથી પધારેલા બંધુઓ તથા માતાઓ અમારા પ્રત્યે સ્નેહની લાગણી ધરાવી આપના ઘરકામ છોડી અત્રે પધાર્યા તે આપનો હું મોટો આભાર માનું છું. વિશેષમાં સભાનો ટાઇમ ઘણો થયો એટલે વિસર્જન કરવામાં આવે છે. અમારા તરફથી આપનું સ્વાગત કરવામાં ન્યુનતા આવી હોય, તેની ક્ષમા યાચના કરશો, એવી હું આપની પાસે આશા રાખું છું.

બોલો શ્રી. લક્ષ્મીનારાયણ દેવકી જય

સંવત ૨૦૦૦ માસ માગસર વદ ૫ વાર ગુરૂ તા. ૧૬ મી ડીસેમ્બર સને ૧૯૪૩ ની રાત્રે નવ વાગે આશરે ગામશ્રી બોરડીટીમ્બા તાબે આંબલીયારા (ભાથીજી) શુભસ્થળ શ્રી. લક્ષ્મીનારાયણના મંદીરમાં આપણી જ્ઞાતિની જનરલ મીટીંગ રા. રા. ભાઇશ્રી હંસરાજભાઇ નારાણભાઇ પટેલ ગામશ્રી રામપૂરા (તાબે માલપુર) વાળાના પ્રમુખપદે ભરવામાં આવી હતી. જેમાં સેક્રેટરી મી. કરશનભાઇ પંચાણભાઇ પટેલ ગામશ્રી બોરડીટીમ્બાવાળા

realpatidar.com

https://archive.org/details/bk786/page/n29/mode/1up

realpatidar.com

તથા જનરલ કમીટીના નીચે લખ્યા સભાસદો તથા જ્ઞાતિના સર્વ સભ્યોની શુભ હાજરીમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં ગામશ્રી રામપૂરા કંમ્પે જનરલ મીટીંગ ભરાયેલી અને ઠરાવો ઘડાયેલા. તેમાં સુધારા વધારા કરી સર્વાનુમતે પસાર કરવામાં આવેલ તેના નામો નીચે મુજબ છે.

પ્રમુખ; શ્રી. રા. રા. હંસરાજભાઇ નારણભાઇ રામપૂરા કમ્પા
મંત્રી; શ્રી. રા. રા. નારણભાઇ રતનશીભાઇ શાન્તીપુરા કમ્પા
સેક્રેટરી; મી. કરશનભાઈ પંચાણભાઇ ઓરડી ટીંમ્બા

卐

realpatidar.com

https://archive.org/details/bk786/page/n30/mode/1up

realpatidar.com

સર પંચનાં નામો

૧ પા. નથુભાઇ લધાભાઈ રામપૂરા
૨ પા. વેલજીભાઈ ભાણજીભાઈ બોરડી ટીમ્બા
૩ પા. શીવજીભાઈ સોમજીભાઈ એદલપુરા
૪ પા. ધનજીભાઇ રાજારામભાઇ સલદારપુરા
૫ પા. મણીભાઇ જેઠાભાઇ મોતેશરી
૬ પા. દેવજીભાઈ નથ્થુભાઈ રણજીતપૂરા
૭ પા. કરશનદાસ ખેતાભાઇ ડેરોલ
૮ પા. જેઠાભાઇ હરીભાઈ રામશી કમ્પા
વતીથી પા શીવજીભાઇ પાચાભાઇ
૯ પા. ગોવિંદભાઇ કરશનદાસ હડમતીયા
વતીથી પા. શામજીભાઇ અરજણભાઇ

કાર્યવાહક સભાસદો.

૧ પા. રામજીભાઇ નાનજીભાઇ હડમતીયા
૨ પા. વશરામભાઈ વાલજીભાઈ ,,
૩ પા. વાલજીભાઇ પ્રેમજીભાઇ રામપુરા
૪ પા. દેવજીભાઈ મનજીભાઇ રાજપુરા
વતીથી પા. માવજીભાઈ જીવરાજભાઈ
૫ પા. શામજીભાઇ હરજીભાઇ બોરડી ટીંમ્બા
૬ પા. દાનાભાઇ માધવજીભાઇ રણજીતપૂરા
વતીથી પા. કાનજીભાઈ માધવજીભાઇ
૭ પા. વીરમભાઇ પરબતભાઇ મોતેસરી
વતીથી સૂત મુલજીભાઈ
૮ પા. હરીભાઇ કરમશીભાઈ મોતેશરી
૯ પા. રામજીભાઇ શીવદાસભાઇ ટીમ્બા તલાવ
૧૦ પા. માનાભાઈ દેવજીભાઇ સાબેડી
૧૧ પા. મનજીભાઈ વસ્તાભાઇ હરિપુરા (મોડાસા)
૧૨ પા. શવગણભાઇ વીરજીભાઇ મોડાસા

realpatidar.com

https://archive.org/details/bk786/page/n31/mode/1up

1943-12-16 -Borditimba -Kutch Kadva Patidar Gnati Sammelan (786)

realpatidar.com

૧૩ પા. કરસનભાઈ દેવશીભાઈ ડુંગરવાડા (મોડાસા)

૧૪ પા. ખેતસીંહભાઇ લખમસીંભાઇ સયડી
વતીથી સુત જેઠાલાલભાઇ

૧૫ પા. રતનશીંભાઈ માંડણભાઈ સયડી

૧૬ પા. ખીમજીભાઇ માવજીભાઇ ટીંબ્બા તલાવ
વતીથી પા. ખેતશીંભાઇ કરસનભાઇ

૧૭ પા. શીવદાસભાઇ ભાણજીભાઈ ઉમેદપુરા (હરસોલ)

૧૮ પા. વશરામભાઇ માવજીભાઇ વાવકમ્પા ,,

૧૯ પા. હરજીભાઈ નાથાભાઇ ખાંડીવાવ

૨૦ પા. રાજારામ માવજીભાઇ સેલરી

૨૧ પા. વશરામભાઇ મેગજીભાઈ ભગત રાયણુનો માળ

૨૨ પા. વશરામભાઈ કરમશીંભાઇ હરિપુરા (આંબલીયારા)

૨૩ પા. શવગણભાઈ વાલજીભાઇ માધવ

૨૪ પા. વશરામભાઈ શીવજીભાઇ માધવ

૧૫૦) છપામણીના ખર્ચનો ૧૫૦)

૨૦) સભામાં વહેંચણી

૬૫ll કાગળોના

(૪) મોટર ભાડાના મોકલ્યા

રૂ.૧૩૦ll

realpatidar.com

realpatidar.com

VSAK: 18-Dec-1943

સ્થળઃ—બોરડીટીમ્બા

સંવત ૨૦૦૦ માસ માગશર વદ ૭ વાર શની હેવાલો બહાર પાડવા માટે આવેલ ફંડની નોંધ

રૂા.

૧૫) બોરડીટીમ્બા સમસ્ત હા. કરસનભાઇ
૨૫) રામપુરા સમસ્ત હા. નથ્થુભાઇ
૨૫) માધવપુરા પા. વાલજીભાઇ ભાણજીભાઇ
૧૦) રામશી સમસ્ત હા. શીવજીભાઇ
૧૦) રણુજીતપુરા સમસ્ત હા. કાનજીભાઇ
૫) મોતેશરી સમસ્ત હા. મુળજીભાઇ
૫) સાબેડી સમસ્ત હા. નાનજીભાઇ
૫) નવાનગર સમસ્ત હા. કરસનભાઇ
૫) હરિપુરા સમસ્ત હા. મનજીભાઇ
૫) શાન્તીપુરા સમસ્ત હા. નારાયણભાઇ
૫) સલદારપુરા સમસ્ત હા. વેલજી
૫) હડમતીયા સમસ્ત સુધારક ભાઇઓ તરફથી
હા. રામજીભાઇ
૫) સયડી સમસ્ત હા. હરજીભાઇ
૧) ખાંડીવાવ સમસ્ત હા. હરજીભાઇ
૧) સેમરી સમસ્ત હા. રામજીભાઇ
૧) કરસનભાઇ દેવશીભાઇ ડુગરવાડા મોડાસા
૫) વિષ્ણુપુરા સમસ્ત હરસોલ હા. અરજણભાઇ
૫) ટીમ્બા તલાવ સમસ્ત હા. ખેતાભાઇ
૫) રાજપુરા સમસ્ત હા. માવજીભાઇ
૧) પા. દેવશીભાઇ ખેતાભાઇ શેરપુરા (ધોળકા)
૨) પા. હીરજીભાઇ કાનજીભાઇ મોતીપુરા
હા. નારાયણભાઇ

realpatidar.com

realpatidar.com

રૂ.

૧) પા. ખેતાભાઇ માવજીભાઇ વાવકં પા હરસોલ
૨) પા. મેગજીભાઇ પેથાભાઇ રામપુરા માલપુર
૫૧ મોડાસા સમસ્ત હા. માવજીભાઇ
૫) પા. વાલજીભાઇ દેવશીભાઇ વાડીયા માધવપુર
૫) પા. નાનજીભાઇ ભાણુજીભાઇ ,, ,,
૧) પા. વસરામભાઇ શીવજી માધવપુરા
૧) પા. રામજીભાઇ લધાભાઇ ,,
૧) અભજીભાઇ તેજાભાઈ ,,
૧) પા. શીવજીભાઇ ખીમજીભાઈ ,,
૫) પા. વેલજીભાઇ પુંજાભાઇ રામપુરા
૧) પા. દેવજીભાઇ રામજીભાઇ ,,

રૂ. ૧૭૪૧

મુદ્રક શા મથુરદાસ મગનલાલ ધી મોડાસા પ્રિન્ટિંગ પ્રેસ-મોડાસા. ઠે બુટાલવાડા.

realpatidar.com